

વાંચન ઝડપ અને અર્થગ્રહણ સંશોધન અંતર્ગત ફીલ્ડ
ઇન્વેસ્ટીગેટર્સ તાલીમ, સર્વે અને ડેટા એન્ટ્રી

તા. ૧૬ અને ૧૯-૦૨-૨૦૨૨, ૨૨-૦૨-૨૦૨૨ થી ૨૫-૦૨-૨૦૨૨,
૨૮-૦૨-૨૦૨૨ થી ૦૩-૦૩-૨૦૨૨

સમગ્ર રાજ્યમાં મેજર રીસર્ચ અંતર્ગત ધોરણ ૨ થી ૮ માં વાંચન ઝડપ અને અર્થગ્રહણ સંશોધન હાથ ધરવાનું થતું હોઈ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા આ માટે જિલ્લાની એક્સ, વાય અને ઝેડ કેટેગરીની શાળાઓની સૂચી અત્રે આપવામાં આવી. જેમાં દરેક ધોરણવાર ૧૦ શાળાઓની પસંદગી કરેલ હતી. આમ જિલ્લાની કુલ ૭૦ શાળાઓ આ સર્વે માટે પસંદ થયેલ હતી.

આ સર્વે પૂર્વે ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ તરીકે એસ.આર.જી./ શિક્ષકોને તાલીમ આપવાનું સૂચવવામાં આવ્યું હતું. તા. ૧૬/૦૨/૨૨ ના રોજ ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ માર્ગદર્શન તાલીમ યોજવામાં આવી, જેમાં જી.સી.ઈ.આર.ટી. દ્વારા ઓનલાઈન તાલીમ આપવામાં આવી. પુનઃ આ તાલીમ તા. ૨૨/૨/૨૨ ના રોજ યોજવામાં આવી. જેમાં વિગતે ડૉ. દશરથ ઓઝા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં શાળાઓમાં જનાર ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ મિત્રોને સવરે માટેના ફરમાઓ, મૂલ્યાંકન પત્રકો સોંપવામાં આવ્યા. ત્યારબાદ આ ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ મિત્રોને તા. ૨૩ અને ૨૪/૨/૨૨ ના રોજ ફિલ્ડમાં મોકલવામાં આવ્યા, ત્યાં તેઓએ સોંપાયેલ ધોરણ અને શાળામાં જઈ દસ બાળકોની માર્ગદર્શિકામાં અપાયેલ પદ્ધતિ અનુસાર પસંદગી કરી વાંચન ઝડપ અને અર્થગ્રહણ કરાવી ઓડિયો રેકોર્ડ કરવાનું હતું. ત્યારબાદ તેઓને તા. ૨૫/૨/૨૨ ના રોજ ડાયટ ખાતે બોલાવી આ ઓડિયો સાંભળી મૂલ્યાંકન કાર્ય કરાવવામાં આવ્યું અને સમગ્ર સાહિત્ય અત્રે જમા લેવામાં આવ્યું. તા. ૨૮/૨/૨૨ થી ૦૩/૦૩/૨૨ દરમિયાન આ તમામ મૂલ્યાંકન શીટ્સ આધારે જી.સી.ઈ.આર.ટી. દ્વારા મોકલવામાં આવેલ એક્સેલ શીટમાં ડેટા એન્ટ્રી કરવામાં આવી. અને નિયત ફોરમેટમાં જી.સી.ઈ.આર.ટી.ને ઇમેલથી માહિતી મોકલવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા માટે જી.સી.ઈ.આર.ટી. દ્વારા એક લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સદર સર્વે માટેની સમગ્ર કામગીરી ડૉ. દશરથ ઓઝાએ સંભાળી હતી.

ફીલ્ડ ઇન્વેસ્ટિગેટર્સ દ્વારા ફીલ્ડ નોટમાં નોંધાયેલા દરેક ધોરણ મુજબના અભિપ્રાયો અને અવલોકનોનું એકંદરી કરવામાં આવ્યું, ઓડિયો ફાઇલોની ડી.વી.ડી. બનાવવામાં આવી. જે બાળકો અક્ષર વાચક છે તેઓની મૂલ્યાંકન શીટ્સ સહીત તમામ સાહિત્ય તા. ૧૪/૦૩/૨૨ ના રોજ જી.સી.ઈ.આર.ટી.ને રૂબરૂ જમા કરાવવામાં આવી.

